

Regd. Off & Factory Site: 74/5-6, Daman Industrial Estate, Kadaiya Village, Nani Daman - 396 210 (Union Territory) • Phone: (0260) 6614400 • Fax : (0260) 2221578; • Website: www.multibaseindia.com • E-mail: compliance.officer@multibaseindia.com • CIN: L01122DD1991PLC002959

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2020

(₹ in lakhs)

Sr No.	Particulars	Quarter ended September 30, 2020 (Unaudited)	Quarter ended June 30, 2020 (Unaudited)	Quarter ended September 30, 2019 (Unaudited)	Half year ended September 30, 2020 (Unaudited)	Half year ended September 30, 2019 (Unaudited)	Year ended March 31, 2020 (Audited)
1	Total Income from Operations	1,431.93	430.56	1,552.00	1,862.49	3,184.10	5,977.61
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	228.18	(13.42)	224.36	214.76	593.08	995.92
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	228.18	(13.42)	224.36	214.76	593.08	995.92
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	171.22	(9.93)	191.14	161.29	452.42	753.99
5	Total Comprehensive Income (Comprising Profit/(Loss) after tax and Other Comprehensive Income after tax)	175.08	(6.07)	190.35	169.01	450.84	769.39
6	Equity Share Capital (Face value of share : ₹10/-)	1,262.00	1,262.00	1,262.00	1,262.00	1,262.00	1,262.00
7	Other Equity						9,429.01
8	Earnings per equity share in ₹						
	(i) Basic:	1.36	(0.08)	1.51	1.28	3.58	5.97
	(ii) Diluted:	1.36	(0.08)	1.51	1.28	3.58	5.97

Notes:

1. The above is an extract of the detailed format of UnAudited financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial results for the quarter ended September 30, 2020 are available on the Stock Exchange Website (www.bseindia.com) and on Company's website (www.multibaseindia.com)

On behalf of Board

Sd/-

Deepak Dhanak

(Managing Director)

(DIN 03157491)

Place: Mumbai

Date: November 11, 2020

Registered Office : Kalyani Tech Park - Survey No 1, 6 & 24 Kundanhalli Village, K R Puram Hobli, Bangalore – 560 066, Karnataka, India CIN: L72200KA2002PLC030072 Tel.: +91 8043640000 Email: compliance@xchanging.com Website: www.xchanging.com

Extract of unaudited consolidated financial results for the quarter and six months ended 30/09/2020

(Rs. in lakhs except for per share data)

Particulars	Quarter ended 30/09/2020 (Unaudited)	Quarter ended 30/06/2020 (Unaudited)	Corresponding quarter ended 30/09/2019 (Unaudited)	For the six months ended 30/09/2020 (Unaudited)	For the six months ended 30/09/2019 (Unaudited)	Year ended 31/03/2020 (Audited)
Total income from operations	5,531	5,956	4,984	11,487	9,761	19,494
Net Profit for the period before tax	1,790	2,235	1,640	4,025	3,163	5,929
Net Profit for the period after tax	1,505	1,849	1,897	3,354	3,055	5,470
Total Comprehensive Income (After tax) for the period	1,178	1,849	2,088	3,027	3,230	6,288
Paid up equity share capital (Face value per share Rs 10/-, fully paid)	11,140	11,140	11,140	11,140	11,140	11,140
Other Equity (excluding Revaluation Reserve)	-	-	-	41,497	35,412	38,470
Earnings per Equity Share (Face value of Rs.10/- each) (not annualised for the quarters)						
Basic- In Rs.	1.35	1.66	1.70	3.01	2.74	4.91
Diluted- In Rs.	1.35	1.66	1.70	3.01	2.74	4.91

Key numbers of Standalone Financial Results

(Rs. in lakhs)

Particulars	Quarter ended 30/09/2020 (Unaudited)	Quarter ended 30/06/2020 (Unaudited)	Corresponding quarter ended 30/09/2019 (Unaudited)	For the six months ended 30/09/2020 (Unaudited)	For the six months ended 30/09/2019 (Unaudited)	Year ended 31/03/2020 (Audited)
Total Income from operations	1,186	1,898	1,378	3,084	3,220	5,838
Net Profit for the period before tax	384	1,114	600	1,498	1,614	2,633
Net Profit for the period after tax	239	775	957	1,014	1,663	2,269
Total Comprehensive Income (After tax) for the period	242	768	959	1,010	1,665	2,272

Notes:

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.xchanging.com/investor-relations/xsl-content.

Place : Hyderabad

Date : November 11, 2020

By Order of the Board of Directors

Chandrasekhara Rao Boddodu

Managing Director and Chief Executive Officer

DIN: 08185777

Registered Office : PTI Building, 4th Floor, Salt Lake Sector V, Kolkata - 700091 T: +91 4015 6000 | CIN: U74140WB1991PLC053189 E-mail: compliance@arohan.in | website: www.arohan.in

Financial Results of Arohan Financial Services Limited (formerly Arohan Financial Services Private Limited) for the half year ended 30th September 2020

(All amounts in lacs of INR, unless otherwise stated)

Sl. No.	Particulars	Half year ended 30th September 2020 (Unaudited)	Corresponding half year ended 30th September 2019 (Audited)	Previous year ended 31 March 2020 (Audited)
1.	Total Income from Operations	49,598.73	45,502.54	92,179.99
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	8,150.96	14,372.71	16,758.54
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	8,150.96	14,372.71	16,758.54
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	6,256.44	10,777.38	12,680.05
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5,136.61	11,070.11	13,510.57
6.	Paid Up Equity Share Capital	11,117.10	11,032.10	11,032.10
7.	Reserves (excluding Revaluation Reserve)	90,409.44	82,621.52	85,230.94
8.	Net worth	1,01,526.54	93,653.62	96,263.04
9.	Paid Up Debt Capital / Outstanding Debt	4,66,937.91	3,57,536.26	4,19,311.23
10.	Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil
11.	Debt Equity Ratio	4.60	3.82	4.36
12.	Earnings Per Share			
	1. Basic : (in INR)	5.75	10.64	12.07
	2. Diluted : (in INR)	5.74	10.62	12.05
13.	Capital Redemption Reserve	Nil	Nil	Nil
14.	Debenture Redemption Reserve	Nil	Nil	Nil

Note:

(a) The financial results of the company have been prepared in accordance with Indian Accounting Standards ("IndAS") notified under Section 133 of the Companies Act 2013 ("the Act") read with the companies (Indian Accounting Standard) Rules, 2015 as amended by the companies Indian Accounting Standards (Amendment) Rules, 2016.

(b) The above is an extract of the detailed format of half yearly financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the half yearly financial results are available on the websites of The BSE Ltd and the Company i.e. www.arohan.in

(c) For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to The BSE Ltd and can be accessed on the Compliance Module of the said Stock Exchange.

By order of the Board

For Arohan Financial Services Limited

Sd/-

Manoj Kumar Nambiar

Managing Director (DIN 03172919)

Place: Kolkata

Date: November 11, 2020

Ph.0172-5041786, 5025090. Fax : 0172-5041709. E-mail: info@paulmerchants.net Website: www.paulmerchants.net REGD. OFF : DSM 335, 336, 337, 3rd Floor, DLF Tower, 15, Shivaji Marg, Najafgarh Road, New Delhi-110015. Ph: 011-48702000.

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30.09.2020 See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015]

(Rs in Lakhs)

Sr. No.	PARTICULARS	Three Months Ended 30.09.2020	Corresponding 3 Months Ended 30.09.2019 in the previous Year	Year to Date Figures 30.09.2020	Previous Year Ended 31.03.2020	Three Months Ended 30.09.2020	Corresponding 3 Months Ended 30.09.2019 in the previous Year	Year to Date Figures 30.09.2020	Previous Year Ended 31.03.2020
		Unaudited	Unaudited	Unaudited	Audited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)	73,955	132,651	105,381	535,768	75,342	133,693	108,030	540,112
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	503	464	772	1,785	1,001	877	1,919	3,736
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	503	464	772	1,656	1,001	877	1,919	3,606
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	410	241	623	1,190	736	546	1,439	2,637
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	417	233	626	1,171	745	538	1,442	2,614
6	Equity Share Capital	102.80	102.80	102.80	102.80	102.80	102.80	102.80	102.80
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	NA	NA	NA	39,042	NA	NA	NA	39,221
8	Earnings Per Share (before extraordinary items) (of Rs 10/- each) for continuing and discontinued operations								
	1. Basic	39.86	23.45	60.61	115.71	71.63	53.16	139.96	256.56
	2. Diluted	39.86	23.45	60.61	115.71	71.63	53.16	139.96	256.56

Notes:

1. The above is an extract of the detailed format of Quarterly and half yearly Un-audited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (LODR) regulations, 2015. The full format of the quarterly results are available on the website of BSE Limited http://www.bseindia.com and are also available on the website of the company http://www.paulmerchants.net.

2. The Company has adopted Ind-As w.e.f. 01.04.2017. This Statement of Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind As) prescribed under the Companies Act, 2013 and Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind-As) alongwith SEBI circular no. CIR/CFD/FAC/62/2016 dated 05.07.2016.

3. The above un-audited Standalone and Consolidated Financial results for the quarter and half year ended September 30, 2020 were reviewed & recommended by the Audit Committee in its meeting held on November 11, 2020 and have been approved and taken on record by the Board of Directors in its meeting held on November 12, 2020.

By order of the Board

Sd/-

Rajneesh Bansal

Din-00077230

Managing Director

Place: Chandigarh

Dated: 12.11.2020

THIS IS A PUBLIC ANNOUNCEMENT FOR INFORMATION PURPOSES ONLY AND DOES NOT CONSTITUTE AN INVITATION OR OFFER TO ACQUIRE, PURCHASE OR SUBSCRIBE TO SECURITIES AND IS NOT A PROSPECTUS ANNOUNCEMENT. NOT FOR RELEASE, PUBLICATION OR DISTRIBUTION, DIRECTLY OR INDIRECTLY, OUTSIDE INDIA.

PUBLIC ANNOUNCEMENT

NURECA

NURECA LIMITED

Nureca Limited ("Company" or "Issuer") was incorporated as 'Nureca Private Limited', as a private limited company, under the Companies Act, 2013 on November 2, 2016 and a certificate of incorporation was issued by Registrar of Companies, Central Registration Centre, at Delhi. The registered office of our Company was changed from Delhi to Mumbai, Maharashtra, pursuant to certificate of registration of regional director order dated January 8, 2019, for change of state issued by the Registrar of Companies, Maharashtra at Mumbai ("RoC") with effect from February 8, 2019. Pursuant to conversion into a public limited company pursuant to a special resolution passed in the extra ordinary general meeting of the shareholders of our Company held on June 19, 2020, the name of our Company was changed to our present name 'Nureca Limited' and a fresh certificate of incorporation was issued by the RoC on July 8, 2020. For details of change in the name and registered office of our Company, see "History and Certain Corporate Matters" on page 120 of the Draft Red Herring Prospectus dated November 10, 2020 ("DRHP").

Registered Office: 128 Gala Number Udyog Bhavan, 1st Floor Sonawala Lane, Goregaon (East), Mumbai - 400063, Maharashtra, India. Tele: +91-22-49616173, Website: www.nureca.com Corporate Office: SCO 6 – 7 – 8, 1st Floor, Sector 9 D, Chandigarh, India. Tele: +91-172-5292900; Contact Person: Gurvikram Singh, Company Secretary and Compliance Officer, E-mail: cs@nureca.com; Corporate Identity Number: U24304MH2016PLCS20868

OUR PROMOTER: SAURABH GOYAL

INITIAL PUBLIC OFFERING OF UP TO [●] EQUITY SHARES OF FACE VALUE ₹ 10 EACH ("EQUITY SHARES") OF NURECA LIMITED ("COMPANY" OR "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ [●] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ [●] PER EQUITY SHARE) ("ISSUE PRICE"), AGGREGATING UP TO ₹ 1,000.00 MILLION ("ISSUE"). THE ISSUE INCLUDES A RESERVATION OF [●] EQUITY SHARES AGGREGATING TO ₹ [●] MILLION ("CONSTITUTING UP TO 5% OF THE POST-ISSUE PAID UP EQUITY SHARE CAPITAL) FOR PURCHASE BY ELIGIBLE EMPLOYEES ("THE EMPLOYEE RESERVATION PORTION"). THE ISSUE LESS THE EMPLOYEE RESERVATION PORTION IS HEREAFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE CONSTITUTES [●]% AND [●]%, RESPECTIVELY OF THE POST-ISSUE PAID-UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

*A DISCOUNT OF ₹ [●] PER EQUITY SHARE MAY BE OFFERED TO ELIGIBLE EMPLOYEES BIDDING IN THE EMPLOYEE RESERVATION PORTION.

THE PRICE BAND AND THE MINIMUM BID LOT SIZE WILL BE DETERMINED BY OUR COMPANY IN CONSULTATION WITH THE BOOK RUNNING LEAD MANAGER ("BRLM"), AND WILL BE ADVERTISED IN ALL EDITIONS OF ENGLISH NATIONAL NEWSPAPER [●], ALL EDITIONS OF HINDI NATIONAL NEWSPAPER [●], AND MUMBAI EDITIONS OF MARATHI NEWSPAPER [●] (MARATHI BEING THE REGIONAL LANGUAGE OF MAHARASHTRA WHERE OUR REGISTERED OFFICE IS LOCATED), EACH WITH WIDE CIRCULATION, AT LEAST TWO WORKING DAYS PRIOR TO THE BID/ISSUE OPENING DATE IN ACCORDANCE WITH THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018, AS AMENDED ("SEBI ICDR REGULATIONS") AND SUCH ADVERTISEMENT SHALL BE MADE AVAILABLE TO THE BSE LIMITED ("BSE") AND NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED ("NSE"), AND TOGETHER WITH BSE, THE "STOCK EXCHANGES") FOR THE PURPOSES OF UPLOADING ON THEIR RESPECTIVE WEBSITES.

In case of any revision to the Price Band, the Bid/Issue Period will be extended by at least three additional Working Days following such revision of the Price Band, subject to the Bid/Issue Period not exceeding 10 Working Days. In cases of force majeure, banking strike or similar circumstances, our Company may in consultation with the BRLM, for reasons to be recorded in writing, extend the Bid/Issue Period for a minimum of three additional Working Days, subject to the Bid/Issue Period not exceeding 10 Working Days. Any revision in the Price Band and the revised Bid/Issue Period, if applicable, will be widely disseminated by notification to the Stock Exchanges, by issuing a public notice, and also by indicating the change on the website of the BRLM and at the terminals of the Syndicate Members and by intimation to Self-Certified Syndicate Banks ("SCSBs"), other Designated Intermediaries and the Sponsor Bank, as applicable.

The Issue is being made through Book Building Process in terms of Rule 19(2)(b) of the Securities Contracts Regulation Rules, 1957, as amended ("SCRR"), read with Regulation 31 of the SEBI ICDR Regulations and is being made through Book Building Process, in compliance with Regulation 6(2) of the SEBI ICDR Regulations, wherein at least 75% of the Net Issue shall be allotted on a proportionate basis to Qualified Institutional Buyers ("QIBs") (the "QIB Portion"), provided that our Company in consultation with the BRLM may allocate up to 60% of the QIB Portion to Anchor Investors on a discretionary basis ("Anchor Investor Portion"). One-third of the Anchor Investor Portion shall be reserved for domestic Mutual Funds, subject to valid Bids being received from the domestic Mutual Funds at or above the Anchor Investor Allocation Price. 5% of the Net QIB Portion (excluding the Anchor Investor Portion) shall be available for allocation on a proportionate basis to Mutual Funds only, and the remainder of the QIB Portion shall be available for allocation on a proportionate basis to all QIBs (other than Anchor Investors), including Mutual Funds, subject to valid Bids being received at or above the Issue Price. If at least 75% of the Net Issue cannot be Allotted to QIBs, all the application monies will be refunded/ unblocked forthwith. Further, not more than 15% of the Net Issue shall be available for allocation on a proportionate basis to Non-Institutional Bidders and not more than 10% of the Net Issue shall be available for allocation to Retail Individual Bidders in accordance with the SEBI ICDR Regulations, subject to valid Bids being received from them at or above the Issue Price. Further, Equity Shares shall be offered for allocation and allotment on a proportionate basis to Eligible Employees applying under the Employee Reservation Portion, subject to valid Bids received from them at or above the Issue Price. All potential Bidders (except Anchor Investors) are required to mandatorily utilise the Application Submitted by Blocked Amount ("ASBA") process providing details of their respective ASBA accounts, and UPI ID (in case of RIBs) if applicable, in which the corresponding Bid Amounts will be blocked by the SCSBs or under the UPI Mechanism, as applicable. Anchor Investors are not permitted to participate in the Issue through the ASBA process. For details, see "Issue Procedure" on page 266 of the DRHP.

This public announcement is being made in compliance with the provisions of Regulation 26(2) of the SEBI ICDR Regulations to inform the public that the Company is proposing, subject to, applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the DRHP with the Securities and Exchange Board of India ("SEBI") on November 11, 2020. Pursuant to Regulation 26(1) of the SEBI ICDR Regulations, the DRHP filed with SEBI shall be made public for comments, if any, for a period of at least 21 days from the date of such filing by hosting it on the website of SEBI at www.sebi.gov.in, websites of Stock Exchanges at www.nseindia.com, www.bseindia.com, and the websites of the BRLM, i.e. ITI Capital Limited at www.iticapital.in. Our Company invites the public to give their comments on the DRHP filed with SEBI, with respect to disclosures made in the DRHP. The members of the public are requested to send a copy of the comments to SEBI, to the Company Secretary and Compliance Officer of our Company and the BRLM at their respective addresses mentioned herein. All comments must be received by SEBI, our Company and / or the Company Secretary and Compliance Officer or the BRLM in relation to the Issue on or before 5.00 p.m. on the 21st day from the aforesaid date of filing of the DRHP with SEBI.

Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in the Issue unless they can afford to take the risk of losing their entire investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in the Issue. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue, including the risks involved. The Equity Shares in the Issue have not been recommended or approved by SEBI, nor does SEBI guarantee the accuracy or adequacy of this Draft Red Herring Prospectus. Specific attention of the investors is invited to "Risk Factors" on page 25 of the DRHP.

Any decision to invest in the Equity Shares described in the DRHP may only be taken after a Red Herring Prospectus has been filed with the RoC and must be made solely on the basis of such Red Herring Prospectus. The Equity Shares, when offered through the Red Herring Prospectus, are proposed to be listed on the Stock Exchanges. For details of the share capital and capital structure of the Company, see "Capital Structure" on page 59 of the DRHP. For details of the main objects of the Company as contained in the Memorandum of Association, see "History and Certain Corporate Matters" on page 120 of the DRHP.

BOOK RUNNING LEAD MANAGER

ITI CAPITAL LIMITED

ITI Capital Limited
Naman Midtown, 'A' Wing, 20th Floor, Senapati Bapat Marg, Elphinstone (West), Mumbai – 400 013, Maharashtra, India. Tel: +91 22 4031 3371
Email: ipo.nureca@iticapital.in
Investor Grievance: investorgrievance@iticapital.in
Website: www.iticapital.in
Contact Person: Pallavi Shinde
SEBI Registration: INM000010924

REGISTRAR TO THE ISSUE

LINKIntime

Link Intime India Private Limited
C-101, 1st floor, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai 400 083, Maharashtra, India. Tel: +91 22 4918 6200
E-mail: nureca-ipo@linkintime.co.in
Investor Grievance: nureca-ipo@linkintime.co.in
Website: www.linkintime.co.in
Contact Person: Shantli Gopalkrishnan
SEBI Registration: INR000004058

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the DRHP.

For NURECA LIMITED

On behalf of the Board of Directors

Sd/-

Company Secretary and Compliance Officer

Place: Mumbai

Date: November 12, 2020

NURECA LIMITED is proposing, subject to, applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the DRHP with SEBI on November 11, 2020. The DRHP shall be available on the websites of SEBI, BSE and NSE at www.sebi.gov.in, www.bseindia.com, www.nseindia.com, respectively, and is available on the website of the BRLM, i.e. ITI Capital Limited at www.iticapital.in. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please see "Risk Factors" beginning on page 25 of the DRHP. Any decision to invest in the Equity Shares described in the DRHP may only be taken after a Red Herring Prospectus for the same has been filed with the RoC and must be made solely on the basis of such Red Herring Prospectus. Potential investors should not rely on the DRHP for making any investment decision.

The Equity Shares offered in the Issue have not been and will not be registered under the U.S. Securities Act or the securities laws of any state of the United States and may not be offered or sold in the United States except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. The Equity Shares are being offered and sold only outside the United States in reliance on Regulation S and the applicable laws of the jurisdictions where such offers and sales occur.

financialexpress.in

ADFACTORS 447

